

જાન્યુઆરી 16, 2018

## બ્રામ્પટન સિટિઝન્સ એવોર્ડ્સ માટે કોઈ મહત્વની વ્યક્તિને નામાંકિત કરવા હજુ પણ સમય બચ્યો છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો - વર્ષ 2017 નાં બ્રામ્પટન સિટિઝન્સ એવોર્ડ્સ માટેના નામાંકનો (નોમિનેશન્સ) જાન્યુઆરી 31 નાં રોજ બંધ થશે.

સીટી ઓફ બ્રામ્પટન સિટિઝન્સ એવોર્ડ્સ કાર્યક્રમ એવા રહેવાસીઓને ઓળખ આપે છે જેઓએ અર્થસભર ફાળો આપ્યો હોય અથવા કોઈ નોંધપાત્ર ઉપલબ્ધિ હાસલ કરી હોય, જેઓને તમે નામાંકિત કર્યા હોય. આ એવોર્ડ્સ કેલેન્ડર વર્ષ 2017 દરમિયાન હાસલ કરેલી ઉપલબ્ધિઓ માટે નીચેના વર્ગોમાં આપવામાં આવે છે: કળા પ્રશંસા (આર્ટ્સ અકલેઈમ), કટોકટી સેવાઓ માટે વીરતાનો એવોર્ડ, પ્રેરણાત્મક કાર્યો, લાંબા ગાળાની સેવા અને સ્મતગમતમાં ઉપલબ્ધિ. વર્ષ 2017 માં સ્વયંસેવક અને વર્ષના જુવાન સ્વયંસેવકના એવોર્ડ્સ નવા એવોર્ડ્સ છે.

સીટી ઓફ બ્રામ્પટનને વર્ષ 1974 થી, સમુદાયમાં શ્રેષ્ઠ રહેવાસીઓને ઓળખ આપવામાં ગૌરવ રહ્યું છે.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે અથવા ઓળખ મેળવવાને લાયક કોઈ મહત્વની વ્યક્તિને નામાંકિત કરવા, વેબસાઈટ જુઓ:  
[www.brampton.ca/citizensawards](http://www.brampton.ca/citizensawards).

### કાર્યક્રમની ઝાંખીઓ

- **સ્પોર્ટ્સ એચિવમેન્ટ એવોર્ડ** (સ્મતગમતમાં ઉપલબ્ધિ પુરસ્કાર) એવા બ્રામ્પટન રહેવાસીઓને ઓળખ આપે છે જેઓની ઉપલબ્ધિઓને પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હોય.
- **આર્ટ્સ અકલેઈમ એવોર્ડ** (કળા પ્રશંસા પુરસ્કાર) એવી વ્યક્તિઓને ઓળખ આપે છે જેઓના ફાળાથી સ્થાનિક, પ્રાંતીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રશંસા હાસલ કરવાના સંદર્ભમાં નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય.
- **લોંગ ટર્મ સર્વિસ એવોર્ડ** (લાંબા ગાળાની સેવા પુરસ્કાર) એવા કટિબદ્ધ સ્વયંસેવકોને ઓળખ આપે છે જેઓના પ્રયત્નોએ મનોરંજનલક્ષી સ્મતો, કળા અને સામુદાયિક સામાજિક સેવાઓ વિકસાવવા અને તેમાં આગળ વધવા તરફ નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હોય.
- **ઇન્સ્પિરેશનલ એવોર્ડ** (પ્રેરણાલક્ષી પુરસ્કાર) બ્રામ્પટનના એવા રહેવાસીઓને ઓળખ આપે છે જેઓ માયાળુ કામગીરી માટેની વકાલત અને/અથવા મહાવરો કરતા હોય, અથવા જેઓએ અન્ય લોકો પર પ્રેરણાત્મક પ્રભાવ પાડ્યો હોય.
- **ઇમરજન્સી સર્વિસ એવોર્ડ ઓફ વેલોર** (કટોકટી સેવાઓ માટે વીરતા પુરસ્કાર) કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ, જેમણે બીજી કોઈ વ્યક્તિનું જીવન બચાવવા પરાક્રમી કાર્ય કરીને પોતાના જીવ/જીવનને સ્વૈચ્છિકપણે જોખમમાં મૂક્યું હોય.
- વર્ષ 2017 માટે નવો એવોર્ડ, **વોલન્ટીયર ઓફ ધી ઈયર એવોર્ડ** (વર્ષનો સ્વયંસેવક પુરસ્કાર) બ્રામ્પટન સ્વયંસેવક તેમજ બ્રામ્પટન જુવાન સ્વયંસેવકને ઓળખ આપે છે જેઓએ ચોક્કસ પ્રવૃત્તિ કે ફાળાને બદલે સર્વાંગી સામુદાયિક સામેલગીરી દેખાડી હોય. આ



**BRAMPTON**  
Flower City

## media release

એવોર્ડ એવા સ્થાનિક રહેવાસીઓને ઓળખ આપે છે જેઓ સમુદાયને ઊંચું લાવતા હોય અને દેખાડે કે જુરસો અને નિર્ધારણથી શું હાસલ કરી શકાય છે.

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

### મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)